اماغياه والمتحدية

મુંબઈ: મહારાષ્ટ્રમાં મોયા સહકારી બેન્કોના કદને નિયંત્રીત

ગજાની પંજાબ અને મહારાષ્ટ્ર સરકારી બેન્કના ઉઠમણા જેવી સ્થિતિ તથા જે રીતે થાપણદારોના 31.99000 કરોડથી વધુ રકમ ફસાઈ છે. તેના પરથી

કરવા જઈ રહી છે જેથી આ બેન્કો નબળી પડે તો પણ મર્યાદીત જ અસર થશે.

વિચારણા કરે છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા શહેરી નાગરિક સહકારી બેન્કોનું વ્યાપારી SE 31.20000 કરોડ સુદી મર્યાદીત રાખવા

હાલ અનેક શહેરી સહકારો બેન્કો જે શેડયુલ બેન્કનો દરજજો ધરાવે છે તેમાં સ્થાનિક સ્તરે જબરૂ નાણાકીય કદ ધરાવે છે અને એકથી વધુ રાજયોમાં તે શાખાઓ ખોલીને એક મીની ખાનગી બેન્ક જેવી બની છે પણ તેના પર રાજયના સહકારી વિભાગ તથા રિઝર્વ બેન્કના બેવડા નિયંત્રણ છે. જેનાથી કોઈનું નિયંત્રણ નહી હોવાની સ્થિતિ છે. આ બેન્કો રાજકીય સંચાલન હેઠળ હોય છે અથવા તો તેનું કદ વધતા રાજકીય પ્રભાવ ધરાવતી બનતા રાજ્ય સરકાર માટે તેના સંચાલકો એક સાથીદાર બની જાય છે િથી તૈયાર્ડી છે. રિઝર્વ બેન્ક શહેરી અને કરવા માંગે છે. તેના પર અસરકારક નિયંત્રણ હોત નથી. રિઝર્વ બેન્ક હવે સહકારી

બેન્કોને વધુમાં વધુ રૂા.૨૦૦૦૦

કરોડનું વ્યાપારી માળખામાં મર્યાદીત

રાખવા માંગે છે અને તેને

સંવેદનશીલ ક્ષેત્રો ખાસ કરીને ખોટા

હાઉસીંગ કે કોમર્સિયલ હાઉસીંગ

પ્રોજેકટમાં ધિરાણ કરવા પર

પ્રતિબંધ મુકશે અને ફક્ત રીટેલ-

હાઉર્સીંગમાંજ ધિરાણ માટે મર્યાદા

મુકશે. રિઝર્વ બેન્ક હવે જાહેર

સહકારીના નિયંત્રણ માટે ખાસ અન્ય નાગરિક બેન્કોમાં સંચાલન અલગ ઓર્યાી સ્થાપવાની પણ માટે પણ નિયમો ઘડે તે નિશ્ચિત નોંધણી કચેરીમાં એક નકલ સાથે.

૧૩, લવેમ્બર ૨૦૧૯ અરજદારનું નામ

૧. રાજેશકુમાર બ્રહ્મભકુ (બીસકલ. કેઝેડ એસ્ટેટ, એલએલપીના અધિકૃત પ્રતિનિધિ)

ર. દિપેશ ગાંધી (ફોનિક્સ મિલ્સ લિમિટેકના અધિકૃત પ્રતિનિધિ)

Kiri Industries Limited

Future full of Colours CIN-L24231GJ1998PLC034094

Reg.Off: 7th Floor, Hasubhai Chambers, Opp. Town Hall, Ellisbrdige, Ahmedabad - 380 006 Phone No. (O) 079-26574371/72/73, (F) 079-26574374, Email: info@kiriindustries.com website: www.kiriindustries.com

Extract of Statement of Consolidated Financial Results for the Quarter and half year ended September 30, 2019

(? in Lakhs

ALCOHOLOGICAL AND ALCOHOLOGICA AND ALCOHO	Quarter Ended		Half Yea	Year Ended	
Particulars Particulars	(30/09/2019) (Unaudited)	Landson Company of the Company of th	(30/09/2019) (Unaudited)	(30/09/2018) (Unaudited)	(31/03/2019) (Audited)
Total income from Operations	32,640.08	37,342.95	69,324.53	70,721.95	1,39,650.41
Net Profit for the period (before Tax, Exceptional and/or	4,026.89	6,311.31	9,066.84	12,170.58	19,105.82
Extraordinary items) Net Profit for the period before tax (after Exceptional and/or	4,026.89	6,311.31	9,066.84	12,170.58	19,105.82
Extraordinary items) Net Profit for the period after tax (after Exceptional and/or	3,411.01	5,391.59	7,338.99	10,454.45	15,762.41
Extraordinary items) Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	11,415.37	11,223.52	12,675.19	19,846.93	16,390.81
Paid up Equity Share Capital	3,362.06	3,134.40	3,362.06	3,134.40	The state of the s
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year.	ijepio iko kelluka	e e e er No seer s	His ARC IS BASS DAS	10 g 10 g 15	1,53,598.54
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -	je jest			13 (1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1	1208 3 2008
Basic:	35.04	35.81	38.90		A Commence of the Commence of
Diluted:	22.02	21.65	24.45	38.29	31.62

Extract from the Standalone Financial Results for the Quarter and half year ended September 30, 2019

(人) 日間本が日本 日、日本の日本の	Quarter Ended		Half Yea	Year Ended	
Particulars			DOMESTIC AND ADDRESS OF THE PARTY OF THE PAR		(31/03/2019)
Faithtia	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
Total Income from Operations	25,231.00	28,332.97	53,062.97	52,409.86	1,06,468.87
Profit Before Tax •	1,549.11	4,139.07	4,409.20	7,690.97	12,634.15
Net Profit for the period after tax	1,288.86	4,091.57	3,881.09	7,597.92	12,004.18

Note:

Date: November 12, 2019

Place: Ahmedabad

- The above is an extract of the detailed Unaudited Quarterly Financial Results ("Results") filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full Financial Results are available on website of Stock Exchanges (www.bseindia.com & www.nseindia.com) as well as on the Company's website www.kiriindustries.com
- The statutory Auditors of the company have carried out a "Limited Review" of the above results as per Regulation 33 of the SEBI [Listing Obligations and Disclosure Requirements] Regulations, 2015
- e Result were reviewed by the Audit committee and thereafter approved by the Board of Directors at their meeting held on

By order of the Board of Directors For Kiri Industries Limited Manish Kiri Managing Director

રીઝર્વ બેન્ક શેડયુલ બેન્કના દરજજા હેઠળ 'મીની ખાનગી બેન્કો' બની રહેલી સહકારી બેન્કોના બિઝનેસને મર્યાદીત કરશેઃ રીટેલ હાઉસીંગ ધિરાણની જ છૂટઃ અલગ રેગ્યુલેટરી આવશે

પંજાબ પોલીસે એક મહિલા સહિત ર ખાલિસ્તાની આતંકવાદી ઝડપ્યા

બોધપાઠ લઈને રિઝર્વ બેન્ક ઓફ

ઈન્ડીયા ખાસ કરીને શહેરી નાગરિક

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૨ પંજાબ પોલીસની ઓપરેશન શાખાએ એક મહિલા સહિત ૨ ખાલિસ્તાની આતંકવાદીને પકડ્યા હોવાનો દાવો કર્યો હતો. આ મહિલા લુધિયાણામાં નર્સ તરીકે કામ કરતી હતી. બીજી અટકાયત ગુરદાસપુરમાં થઇ હતી.

પોલીસે એવી માહિતી આપી હતી કે આ બંને ખાલિસ્તાની આતંકવાદીઓ હિન્દુ નેતાઓની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. ઉપરાંત પંજાબમાં નવેસર ખાલિસ્તાન તરફી આંદોલન શરૂ કરવાની તેમની યોજના હતી.

સુરક્ષા દળોને વધુ એક મોટી સફળતા હાથ લાગી

કાશ્મીરમાં ત્રાસવાદીઓની સામે સુરક્ષા દળોનુ ઓપરેશન ઓલઆઉટ જારી રહ્યુ છે. કાશ્મીર ખીણના ગન્દરબાલ વિસ્તારમાં અથડામણ દરમિયાન સુરક્ષા દળોને આજે મોટી સફળતા હાથ લાગી હતી. ચર્ચ ઓપરેશન હજુ પણ જારી છે. સવારે સાત વાગ્યાથી અથડામણ સ્થળ પર

ગોળીબારની શરૂઆત થઇ હતી. કલાકો સુધી અથડામણ થયા બાદ બે ત્રાસવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા. આજે સવારે ગંદરબાલના ગુન્ડમાં ત્રાસવાદીઓ એક ઘરમાં છૂપાયા હોવાના હેવાલ મળ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ સુરક્ષા દળોએ ત્યાં પહોંચીને વિસ્તારને ઘેરી લઇને તમામ કામગીરી હાથ

ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ છુપાયેલા ત્રાસવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જવાબી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જેમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. સેનાના એક જવાનને પણ ઇજા થઇ હતી. સોમવારના દિવસે પણ એક ગાસવાદી ઠાર થયો હતો. શ્રીનગરથી ૫૫ કિલોમીટરના અંતરે સ્થિત લાવદારા ગામમાં ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ હતી. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદી બાદથી મોટા પાયે ઓપરેશન સેના દ્વારા જારી રાખવામાં આવ્યા છે.

CHANG OF ADDRESS

We Have Changed Our Office & MFG Address From

Setu (India)

83/8, Phase-1, GIDC Estate, V

Block No. 195, Godown No. 2, Nr. Umiyapura Bus Stop, Bareja To Barejadi Road, Vill:- Bidaj, Disk Kheda-387120, Gujarat (India)

રાષ્ટ્રપતિ શાસન બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા આવી

મહારાષ્ટ્રમાં રાજ્યપાલે ખુબ ઉતાવળમાં કામ કર્યું : કે



હતી. તમામ વિકલ્પોની ચકાસણી કર્યા વગર જે રીતે ઉતાવળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે તે બાબત વખોડવા પાત્ર છે. તેમૃકો એમ પણ કહ્યું છે કે, આને લઇને અનેક પ્રશ્નો ઉભા થાય છે. રાજ્યપાલની નિષ્પક્ષતાને લઇને પ્રશ્નો ઉભા થાય છે. ઉપરાંત રાજ્યપાલ દબાણ

DEEP INDUSTRIES LIMITED

12A & 14, Abhishree Corporate Park, Ambli Bopal Road, Ambli, Ahmedabad - 380 058. Ph.: 02717-298510 Fax: 02717-298520 CIN:L630906J1991PLC014833 E-mail:cs@deepindustries.com Website: http://www.deepindustries.com

Extracts of Unaudited Financial Results (Standalone & Consolidated) for the quarter and half year ended 30th September, 2019

20

FINANCIAL EXPRESS

JBF INDUSTRIES LIMITED

(CIN:L99999DN1982PLC000128)

Fel:+91-0260-264274546 Fax:+91-0260-2642297

Corporate Office: 8th Floor, Express

Fowers, Nariman Point, Mumbai - 400021

Website: http://www.jbfindia.com

This is to inform you that the Board of

Directors of our Company will meet on

Thursday, 21st November, 2019, on re-

scheduled meeting which will be held at

corporate office of the Company, at 14.30.

hrs. to consider Unaudited Financial

Statements for the quarter ended on 30th

Further, the closure of Trading Window

for dealing in the securities of the Company

will be closed on 14th November, 2019 to

22nd November, 2019 both days inclusive.

This intimation is also available on

Company's website: www.jbfindia.com

and also on stock exchanges website:

www.bseindia.com and www.nseindia.com

For

Advertising in

TENDER PAGES

Contact

JITENDRA PATIL

Mobile No.:

9029012015

Landline No.:

67440215

For JBF Industries Limited

Mrs. Ujjwala Apte

Company Secretary

September, 2019.

Registered Office: Survey no.273, Village Athola, Silvassa - 396230.

INTERWORLD DIGITAL LIMITED CIN:L72900DL1995PLC067808 Regd: Off.: 701, Arunachal Building, 19. Barakhamba Road, Connaught Place, New Delhi- 110001 Phone: 011-43571044-45; Fax: 011-43571047, Website: www.interworlddigital.in, Email: interworlddigital.in@gmail.com Regd. Off.: 702, Arunachal Building, 19, Barakhamba Road. Connaught Place, New Delhi-110001 Phone: 011-43571044; Fax: 011-43571047, Website: www.rocoaments.com, Email: roccamentslimited@gmail.com

SN	Particulars	For The Quarter ended 30.09.2019 (Un-audited)	For The Half year ended 30.09.2019 (Un-audited)	For The Quarte ended 30.09.2018 (Un-audited)
1	Total income from operations (net)	0.00	0.00	0.00
2	Net Profit/ (Loss) for the period (before tax, exceptional and/ or Extraordinary items)	(19.55)	(38.11)	(27.26)
3	Net Profit/ (Loss) for the period before tax (after exceptional and/ or Extraordinary items)	(19.55)	(38.11)	(27.26)
4	Net Profit/ (Loss) for the period after tax (after exceptional and/ or Extraordinary items)	(17.80)	(33.31)	(24.02)
5	Total comprehensive income for the period (Comprising Profit/ (loss) for the period (after tax) and	Noncestal.	715-S-17	196454260
	other Comprehensive income (after tax))	(17,80)	(33.31)	(24.02)
8	Equity Share Capital	4783.77	4783.77	4783.77
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	0.00	0.00	0.00
8	Earnings Per Share (of Rs.1/- each) (for continuing and discontinued operation)	7-3,5	5-3-92	
	Basic:	(0.00)	(0.01)	(0.01)
	Diluted:	(0.00)	(0.01)	(0.01)

The above is an extract of the detailed format of Unaudited Financial Results for the Quarter and half year ended September 30, 2019 filed with the BSE under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirments) Regulations, 2015. The full format of the aforesaid Quarterly Financial Results is available on the BSE's website, i.e., www.bseindia.com and on the Company's website www.interworlddigital.in. The above Unaudited Financial results are prepared in accordance with the Companies (Ind AS) Rules, 2015. For and on behalf of Board Directors of Interworld Digital Limited

Place: New Delhi Date: 12/11/2019

LUMAX

Peeyush Kumar Aggarwal

Chairman

DIN: 00090423

Email: shares@lumaxmail.com, CIN: L31909DL1981PLC349793

Lumax Auto Technologies Limited Regd. Office: 2" Floor, Harbans Bhawan-II, Commercial Complex, Nangal Raya, New Delhi-110046 Website: www.lumaxworld.in/lumaxautotech Tel: +91 11 49857832



(₹In Lakhs unless otherwise stated)

For The For The Half

30.09.2019

(Un-audited)

0.00

(3.13)

(3.13)

(3.13)

(3.13)

560.20

0.00

(0.06)

(0.06)

Quarter ended year ended Quarter ended 30.09.2019 30.09.2019 30.09.2018

(Un-audited)

0.00

(5.55)

(5.55)

(5.55)

(5.55)

560.20

0.00

(0.10)

(0.10)

For and on behalf of Board Directors of

RCC Cements Limited

Managing Director DIN: 00175301

Sunil Kumar

For The

30.09.2018

Un-audited

0.00

(2.98)

(2.98)

(2.98)

(2.98)

560.20

0.00

(0.05)

(0.05)

RCC CEMENTS LIMITED

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS

FOR THE QUARTER & HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2019

The above is an extract of the detailed format of Unaudited Financial Results for the Quarter and half year

ended September 30, 2019 filed with the BSE under Regulation 33 of the SEBI (Listing and Other

Disclosure Requirments) Regulations, 2015. The full format of the aforesaid Quarterly Financial Results

s available on the BSE's website, i.e., www.bseindia.com and on the Company's website

www.rcccements.com. The above results are prepared in accordance with the Companies Ind AS

Particulars

Total income from operations (net)

Net Profit/ (Loss) for the period (before tax,

exceptional and/ or Extraordinary items)

Net Profit/ (Loss) for the period before tax

Net Profit/ (Loss) for the period after tax

(after exceptional and/ or Extraordinary items)

(after exceptional and/ or Extraordinary items)

(Comprising Profit/ (loss) for the period (after tax) and

Reserves (excluding Revaluation Reserve) as shown

Earnings Per Share (of Rs. 10/- each) (for continuing

in the Audited Balance Sheet of the previous year

Total comprehensive income for the period

other Comprehensive income (after tax))

Equity Share Capital

Basic:

Diluted:

Place: New Delhi

Date: 12/11/2019

and discontinued operation)

STATEMENT OF CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULTS FOR THE SECOND QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2019

Sr. No.	Particulars	Quarter ended 30.09.2019 (Unaudited)	Half year ended 30.09.2019 (Unaudited)	Quarter ended 30.09.2018 (Unaudited)
1	Revenue from contracts with customers	29,363.04	58,117.07	31,474.08
2	Net Profit for the period before tax (before exceptional items)	1,851.79	3,647.91	2,692.69
3	Net Profit for the period before tax (after exceptional items)	1,851.79	3,647.91	2,163.61
4	Net Profit for the period after tax from Continuing Operations	1,988.85	3,145.84	1,411.96
5	Net Profit for the period before tax from Discontinued Operations	(*)	948.58	548.77
6	Net Profit for the period after tax from Discontinued Operations	208.18	825.29	362.19
7	Net Profit after tax (including non- controlling interest)	2,197.03	3,971.13	1,774.15
8	Net Profit for the period / year (after taxes and non- controlling interest)	2,291.84	4,035.34	1,823.98
9	Total Comprehensive income for the period/year (after non-controlling interest)	(163.40)	(2,956.87)	(256.46
10	Equity Share Capital (in ₹)	1,363.15	1,363.15	1,363.15
11	Earning per share (₹ Per share of face value of ₹ 2 each) Earnings per share for continuing operations: (In ₹) Basic & Diluted (in ₹)	3.06	4.71	2.14
	Earnings per share for Discontinued operations: (In ₹) : Basic & Diluted (in ₹)	0.30	1.21	0.54
	Earnings per share for Continuing and Discontinued operations: (In $\overline{\epsilon}$) : Basic & Diluted (in $\overline{\epsilon}$)	3.36	5.92	2.68
	Key Standalone Financial Information			
1	Revenue from Operations	24,716.95	48,292.85	25,251.34
2	Profit Before Tax from Continuing operations	2,058.51	3,687,88	2,219.60
3	Profit Before Tax from Discontinued operations	// 🗷	948.58	548.77
4	Total Comprehensive Income / (Loss) for the period	2,237.09	1,135.61	1,693.23


Notes:

- The above results for the quarter and half year ended September 30, 2019 were reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on November 12, 2019. The unaudited results for the current quarter and half year have been reviewed by the Statutory Auditor.
- 2. The above is an extract of the detailed format of the Financial Results for the quarter and half year ended September 30, 2019, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results for the quarter and half year ended September 30, 2019, are available on the Stock Exchange websites of NSE (www.nseindia.com) and BSE (www.bseindia.com) or Company's website (www.lumaxworld.in/lumaxautotech).

For and on behalf of the Board of Directors

Place : Gurugram Date: November 12, 2019

D K Jain Chairman



Future Full of Colours

CIN-L24231GJ1998PLC034094 Reg.Off: 7th Floor, Hasubhai Chambers, Opp. Town Hall, Ellisbrdige, Ahmedabad - 380 006 Phone No. (O) 079-26574371/72/73, (F) 079-26574374, Email: info@kiriindustries.com website: www.kiriindustries.com

Extract of Statement of Consolidated Financial Results for the Quarter and half year ended September 30, 2019

(₹in Lakhs)

	Quarter Ended		Half Yea	Year Ended	
Particulars	(30/09/2019) (Unaudited)	(30/09/2018) (Unaudited)	(30/09/2019) (Unaudited)	(30/09/2018) (Unaudited)	(31/03/2019) (Audited)
Total income from Operations	32,640.08	37,342.95	69,324.53	70,721.95	1,39,650.41
Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	4,026.89	6,311.31	9,066.84	12,170.58	19,105.82
Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	4,026.89	6,311.31	9,066.84	12,170.58	19,105.82
Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	3,411.01	5,391.59	7,338.99	10,454.45	15,762.41
Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	11,415.37	11,223.52	12,675.19	19,846.93	16,390.81
Paid up Equity Share Capital	3,362.06	3,134.40	3,362.06	3,134.40	3,134.40
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year.		17		ă	1,53,598.54
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -					
Basic:	35.04	35.81	38.90	63.32	52.29
Diluted:	22.02	21.65	24.45	38.29	31.62

Extract from the Standalone Financial Results for the Quarter and half year ended September 30, 2019

(₹in Lakhs)

	Quarter	Quarter Ended			Year Ended	
Particulars	(30/09/2019)	(30/09/2018)	(30/09/2019)	(30/09/2018)	(31/03/2019)	
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)	
Total Income from Operations	25,231.00	28,332.97	53,062.97	52,409.86	1,06,468.87	
Profit Before Tax	1,549.11	4,139.07	4,409.20	7,690.97	12,634.15	
Net Profit for the period after tax	1,288.86	4,091.57	3,881.09	7,597.92	12,004.18	

- 1. The above is an extract of the detailed Unaudited Quarterly Financial Results ("Results") filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full Financial Results are available on website of Stock Exchanges (www.bseindia.com & www. nseindia.com) as well as on the Company's website www.kiriindustries.com.
- 2. The statutory Auditors of the company have carried out a "Limited Review" of the above results as per Regulation 33 of the SEBI [Listing Obligations and Disclosure Requirements] Regulations, 2015.
- 3. The above Result were reviewed by the Audit committee and thereafter approved by the Board of Directors at their meeting held on November 12, 2019.

By order of the Board of Directors For Kiri Industries Limited Managing Director

CORDS CABLE INDUSTRIES LIMITED Registered Office: 94, 1st Floor, Shambhu Dayal Bagh Marg, Near Okhla Industrial Area Phase-III, Old Ishwar Nagar, New Delhi-110020 Tel: 011-40551200 * Fax: 011-40551280/81 * E-mail: ccil@cordscable.com Website: www.cordscable.com * CIN: L74999DL1991PLC046092

ks in Lakns		31 18103	5 /	52 // No	- 120 V	
Previous Year Ende 31/03/2019 Audited	Half Year Ended 30/09/2018 Un-audited	Half Year Ended 30/09/2019 Un-audited		Quarter Ended 30/06/2019 Un-audited	Quarter Ended 30/09/2019 Un-audited	Particulars
41850.01	19168.52	21114.63	9961.09	11050.56	10064.08	Total income from operations
1133.98	476.27	639.08	278.40	258.41	380.67	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)
1133.98	476.27	639.08	278.40	258.41	380.67	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)
735.42	312.39	382.25	175.54	159.54	222.72	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)
736.25	311.36	382.65	174.50	159.74	222.92	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]
1292.78	1292.78	1292.78	1292.78	1292.78	1292.78	Equity Share Capital(Paid up) (Face Value of Rs 10/- each)
12169.26		-		-	-	Reserve (excluding Revaluation Reserves)
584-570-57-58						Earnings Per Share (for continuing and discontinued operations)
5.70	2.41	2.96	1.35	1.24	1.72	(a) Basic
5.70	2.41	2.96	1.35	1.24	1.72	(b)Diluted

The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company in their meeting held on 12th November, 2019. The statutory auditor have expressed an unqualified report on the above results.

Company. The above is an extract of the detailed format of the standalone financial results for Quarter and Half Year ended on Septembe

The Company is operating in a single segment as defined in Ind AS-108, Hence segment reporting is not applicable to the

30,2019 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Other Disclosure Requirements Regulations, 2015. The full format of the Financial Results are available on the websites of the Stock Exchange(s (www.bseindia.com, www.nseindia.com) and on the Company's website. (www.cordscable.com). iv) The company does not have any other exceptional item to report for the above periods.

133 of the Companies Act, 2013 read with rule 3 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 and Companies (Indian Accounting Standards) Amendment Rules, 2016 and in terms of SEBI(Listing Obligation and Disdosure Requirement Regulations, 2015 vi) The figures of previous quarters / year are reclassified, regrouped and rearranged wherever necessary so as to make them

The standalone results have been prepared in accordance with Indian Accounting Standards (Ind AS) prescribed under Section

comparable with current period's figures.

By order of the Board For Cords Cable Industries Limited Naveen Sawhney

(Managing Director

DIN: 00893704

Place: New Delhi Date: 12.11.2019

LUMAX

LUMAX INDUSTRIES LIMITED

Regd. Office: 2" Floor, Harbans Bhawan-II, Commercial Complex, Nangal Raya, New Delhi-110046 Website: www.lumaxworld.in/lumaxindustries, Tel: +91 11 49857832

Email: lumaxshare@lumaxmail.com, CIN: L74899DL1981PLC012804

DK JAIN GROUP

EXTRACT OF CONSOLIDATED UNAUDITED RESULTS FOR THE QUARTER AND SIX MONTHS ENDED 30TH SEPTEMBER 2019

(₹ In Lakhs unless otherwise stated)

PARTICULARS	Quarter ended 30 September 2019 (Un-audited)	Half year ended 30 September 2019 (Un-audited)	Quarter ended 30 September 2018 (Un-audited)
Total Revenue from operations	42,902.85	83,105.20	50,477.53
Net Profit / (Loss) from ordinary activities before tax (before exceptional items)	2,646.50	4,914.49	2,595.87
Net Profit / (Loss) for the period before tax (after exceptional items)	2,646.50	4,914.49	2,595.87
Net Profit / (Loss) after tax	2,008.11	3,664.19	2,087.02
Total comprehensive income	1,956.42	3,530.81	2,019.89
Equity Share Capital	934.77	934.77	934.77
Earnings per share (of ₹ 10 each) (for continuing operations):			
Basic:	21.48	39.20	22.33
Diluted:	21.48	39.20	22.33

Notes:

- Based on the guiding principles given in Ind AS-108 on 'Operating Segments', the Company's business activity fall within a single operating segment. Accordingly, the disclosure requirements of Ind AS-108 are not applicable.
- 2. Key information on Standalone Financial Results is as follows:

PARTICULARS	Quarter ended 30 September 2019 (Un-audited)	Half year ended 30 September 2019 (Un-audited)	Quarter ended 30 September 2018 (Un-audited)
Total Revenue from operations	42,902.85	83,105.20	50,477.53
Profit before tax	2,519.91	4,477.32	3,398.95
Net Profit / (Loss) after tax	1,895.15	3,288.63	2,729.95

- 3. The above results for the quarter and half year ended 30 September 2019 were reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 12 November 2019. The unaudited results for the current guarter and half year have been reviewed by the Statutory Auditor.
- 4. The above is an extract of the detailed format of the Financial Results for the quarter and half year ended 30 September 2019, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results for the quarter and half year ended 30 September 2019, are available on the Stock Exchange websites of NSE (www.nseindia.com) and BSE (www.bseindia.com) or Company's website (www.lumaxworld.in/lumaxindustries).

For and on behalf of the Board of Directors

Deepak Jain

Place: Gurugram Date: 12 November 2019

Chairman & Managing Director



Tamilnadu Petroproducts Limited

Regd.Office: Manali Express Highway, Manali, Chennai 600 068 CIN:L23200TN1984PLC010931 Phone /Fax: No. 044-25945588 website:www.tnpetro.com Email:secy-legal@tnpetro.com

EXTRACT FROM THE STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND SIX MONTHS ENDED 30[™] SEPTEMBER 2019

(Rs.in lakhs)

Sl.no		Quarter ended			Six mon	ths ended	Year
	Particulars	30.09.2019 Unaudited	30.06.2019 Unaudited	30.09.2018 Unaudited	30.09.2019 Unaudited	30.09.2018 Unaudited	ended 31.03.2019 Audited
1.	Total Income from operations	34,329	34,542	33,695	68,871	61,502	1,25,546
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and Extraordinary items)	2,554	2,534	2,258	5,088	3,856	7,451
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and Extraordinary items)	2,554	2,534	2,258	5,088	3,856	7,451
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and Extraordinary items)	2,189	1,991	2,005	4,180	3,012	5,703
5.	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	2,224	1,978	2,648	4,202	3,919	6,375
6.	Equity Share Capital	8,997	8,997	8,997	8,997	8,997	8,997
7.	Other Equity as shown in the Audited Balance Sheet	53700	100			-	33,517
8.	Earnings per Share (EPS) (of Rs.10 /- each)(for continuing operations)						2
	Basic and Diluted	2.43	2.22	2.23	4.65	3.35	6.34

1.Additional information on Standalone Financial Results pursuant to proviso to Reg. 47(1)(b)

Particulars	C	Quarter ended				Year	
	30.09.2019 Unaudited	30.06.2019 Unaudited	30.09.2018 Unaudited	30.09.2019 Unaudited	30.09.2018 Unaudited	ended 31.03.201 Audited	
Total Income from Operations	34,215	34,439	33,614	68,654	61,347	1,25,229	
Profit Before Tax	2,444	2,447	2,186	4,891	3,719	7,168	
Profit After Tax	2,089	1,904	1,933	3,993	2,875	5,427	
Total Comprehensive income after Tax	1,824	1,914	1,941	3,738	2,826	5,468	

- 2. The above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their Meetings held on 11th November 2019 and have been subjected to limited review by the Statutory Auditors of the Company.
- 3. The above is an extract from the Financial Results for the Quarter and six months ended 30th September 2019 filed with the Stock Exchanges under Regulation 33 of the of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Financial Result are available in the website of the Company www.tnpetro.com and the websites of the Stock Exchanges viz., www.bseindia.com and www.nseindia.com.

By Order of the Board For Tamilnadu Petroproducts Limited K.T. Vijayagopal Whole-time Director (Finance) & CFO

Date: November 12, 2019 paper Aftimedabad lexpress.com

Place: Chennai Manish Kiri Date: 11th November, 2019